



MAE-7851 **Seat No.** _____

Third Year B. Com. (Non CBCS) Examination
February - 2018
Compulsory Statistics

Time : 3 Hours]

[Total Marks : 100

- સૂચના :** (૧) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
(૨) જમણી બાજુએ ગુણ દર્શાવ્યા છે.
(૩) આંકડાશાસ્ત્રીય કોષ્ટકો વિનંતીથી આપવામાં આવશે.

૧ (અ) નીચેના પદો સમજાવો :

- (૧) નિર્દર્શ અવકાશ
(૨) સમસંભાવી ઘટનાઓ
(૩) નિરપેક્ષ ઘટનાઓ
(૪) પરસ્પર નિવારક ઘટનાઓ.

(બ) જો $P(A)=0.6, P(B)=0.5$ અને $P(A \cup B)=0.8$ હોય તો ₹

- (૧) $P(A \cap B)$
(૨) $P(A' \cap B')$
(૩) $P\left(\frac{A}{B}\right)$ શોધો.

(ક) એક પેટીમાં 4 કાળા અને 3 સર્કેટ દઢાઓ છે, તેમાંથી 2 દઢા યદચ્છ રીતે ₹
લેવામાં આવે તો (૧) બંને દઢા કાળા હોવાની (૨) બંને દઢા સર્કેટ હોવાની
(૩) બંને દઢા જુદા-જુદા રંગના હોવાની સંભાવના શોધો.

અથવા

- ૧ (અ) પોયસન વિતરણાના ગુણાધર્મો અને ઉપયોગો જણાવો.
 (બ) એક યદૃચ્છા ચલ જ્ઞાન સંભાવના વિતરણ નીચે પ્રમાણ છે :

x :	-2	-1	0	1	2
$P(x)$:	0.2	K	0.3	$3K$	0.1

(૧) K (૨) $E(x)$ (૩) $V(x)$ શોધો.

- (ક) એક દ્વિપદી વિતરણમાં $n=10$, $2P(x=4)=P(x=5)$ એ તો મધ્યક અને વિચરણ શોધો.

- ૨ (અ) સુરેખ આયોજનના ઉપયોગો અને મર્યાદાઓ જણાવો.
 (બ) નીચે આપેલ માહિતી પરથી આલેખની રીતથી સુરેખ આયોજન પ્રશ્નનો
 ઉકેલ શોધો :

$$5x + 7y \leq 70, \quad x + y \leq 12, \quad x, y \geq 0$$

શરતોને આધીન $Z = 15x + 20y$ ની કિંમત મહત્વમાં થાય તે રીતે x અને y ની કિંમત શોધો.

- (ક) એક પ્રામાણ્ય વિતરણમાં ત્રીજા અને પ્રથમ ચતુર્થકાળો સરવાળો અને તફાવત અનુકૂલમાં 80 અને 20 છે. પ્રામાણ્ય વિતરણના પ્રાચલો શોધો.

અથવા

- ૨ (અ) સાખિત કરો કે

(૧) $AH = G^2$

(૨) $A > G > H$

(બ) $4 + 44 + 444 + \dots \dots \dots$ ના n પદોનો સરવાળો શોધો.

(ક) $72 + 70 + 68 + \dots \dots \dots + 40$ નો સરવાળો શોધો.

- ૩ (અ) સ્પિયરમેનના કમાંક સહસંબંધાંક પર નોંધ લખો. ૮
 (બ) કાર્બ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો અને સંભવિત દોષ શોધો : ૧૨

$x:$	3	4	6	7	10
$y:$	9	11	14	15	16

અથવા

- ૩ (અ) નિયતસંબંધાંકોની વ્યાખ્યા આપો. તેના ગુણધર્મો જણાવો. ૮
 (બ) બે નિયતસંબંધ રેખાઓ $3x + 2y = 26$ અને $6x + y = 31$ એટાની સંબંધાંક શોધો. ૧૨

$$\sigma_x = 5 \text{ હોય તો } \bar{x}, \bar{y}, r \text{ અને } \sigma_y \text{ શોધો.}$$

- ૪ (અ) જીવનનિર્વાહના સૂચક આંક પર ટૂકનોંધ લખો. ૮
 (બ) નીચે આપેલ માહિતી પરથી $I_L, I_P, I_F, I_{D.B}$ અને $I_{M.E}$ શોધો. ૧૨

વસ્તુઓ	આધાર વર્ષ		ચાલુ વર્ષ	
	કિમત	જથ્થો	કિમત	જથ્થો
A	6	10	9	10
B	5	15	10	14
C	10	12	8	10
D	9	10	12	12
E	8	8	12	7

અથવા

- ૪ (અ) ગુણાત્મક સંબંધ સમજાવો. ગુણાત્મક સંબંધનો પ્રકાર સમજાવો. ૮
 (બ) નીચે આપેલ માહિતી પરથી બંને શહેરમાં કેળવણી અને ગુના વચ્ચેનો ગુણાત્મક સંબંધ તપાસો : ૧૨

	શહેર-A	શહેર-B
કુલ વસ્તી	240	234
શિક્ષિત	40	34
ગુનેગાર	40	20
શિક્ષિત ગુનેગાર	5	2

- ૪ (અ) સમાણ્ટ તપાસ અને નિર્દર્શી તપાસ વચ્ચેનો તફાવત આપો. ૮
- (બ) એક સમાણ્ટના અવલોકનો 2, 3, 5, 6 છે. તેમાંથી પુરવજી રહિત બળે ૬ એકમોના કેટલા નિર્દર્શી લઈ શકાય ? નિર્દર્શી મધ્યકોનો મધ્યક સમાણ્ટ મધ્યક બરાબર છે. તે પરિણામની ચકાસણી કરો અને નિર્દર્શી મધ્યકનું વિચરણ મેળવો.
- (ક) નીચેની માહિતી માટે \bar{Y}_{st} અને $V(\bar{Y}_{st})$ શોધો : ૬

$$N_1 = 5, n_1 = 2, \bar{Y}_1 = 8, S_1^2 = 21.5$$

$$N_2 = 4, n_2 = 2, \bar{Y}_2 = 7, S_2^2 = 18.5$$

અથવા

- ૫ (અ) ધંધાકીય પૂર્વનુમાન માટે ઉપયોગમાં લેવાતી બે રીતો સમજાવો. ૮
- (બ) નીચેની માહિતી માટે દ્વિધાતી પરવલય વકનું અન્વાયોજન કરો અને વર્ષ 2018ની કિમતનું આગણાન કરો : ૧૨

વર્ષ :	2013	2014	2015	2016	2017
કિમત :	10	12	13	10	8

ENGLISH VERSION

- Instructions :** (1) All questions are compulsory.
(2) Marks are indicated on right side.
(3) Statistical tables will be given on request.

- 1 (a) Explain the following terms : 8
- (1) Sample space
 - (2) Equally likely events
 - (3) Independent events
 - (4) Mutually exclusive events.

(b) If $P(A) = 0.6$, $P(B) = 0.5$ and $P(A \cup B) = 0.8$ then find 6

(1) $P(A \cap B)$

(2) $P(A' \cap B')$

(3) $P(A/B)$.

(c) A box contains 4 black and 3 white balls two balls 6

are taken at random from it. Find the prob. that (1) both balls are black (2) both balls are white (3) both balls are of different colours.

OR

1 (a) State the properties and uses of Poisson distribution. 8

(b) The probability distribution of a r.v. x is as follows 6

$x:$	-2	-1	0	1	2
$P(x):$	0.2	K	0.3	$3K$	0.1

Find : (1) K (2) $E(x)$ (3) $V(x)$

(c) For a binomial distribution $n=10$, $2P(x=4)=P(x=5)$ 6

then find the mean and variance.

2 (a) State the applications and limitations of Linear 8
programming.

(b) Solve the following L.P.P. by using graphical method : 6

If $5x+7y \leq 70$, $x+y \leq 12$, $x, y \geq 0$ then

obtained the values of x and y maximize $Z = 15x+20y$.

- (c) For a normal distribution, sum and difference of first and third quartile are 80 and 20 respectively. Find parameters of normal distribution. 6

OR

- 2** (a) Prove that 8

$$(1) AH = G^2$$

$$(2) A > G > H$$

- (b) Find the sum of n terms of 6

$$4 + 44 + 444 + \dots$$

- (c) Find the sum of $72 + 70 + 68 + \dots + 40$. 6

- 3** (a) Write a note on Spearman's rank correlation coefficient. 8

- (b) Find correlation coefficient by Karl Pearson's method and find probable error. 12

$x:$	3	4	6	7	10
$y:$	9	11	14	15	16

OR

- 3** (a) Define the regression coefficients. State its properties. 8

- (b) $3x + 2y = 26$ and $6x + y = 31$ are the regression line 12

equations $\sigma_x = 5$ then find out \bar{x}, \bar{y}, r and σ_y .

- 4** (a) Write short note on cost of living index number. 8

- (b) Find $I_L, I_P, I_F, I_{D.B}$ and $I_{M.E}$ from the following data : 12

Commodities	Base year		Current year	
	Value	Quantity	Value	Quantity
A	6	10	9	10
B	5	15	10	14
C	10	12	8	10
D	9	10	12	12
E	8	8	12	7

OR

- 4 (a) Explain association of attributes and types of association of attributes. 8
(b) Test the association of attributes for education and crime for the given data : 12

	City-A	City-B
Population	240	234
Educated	40	34
Crimeholder	40	20
Educated and criminal	5	2

- 5** (a) Give the difference between complete enumeration and sample enumeration. **8**

(b) A population consists of 2, 3, 5, 6 observations. **6**
 Write down all possible samples of size two without replacement. Verify that mean of sample means is equal to population mean and find variance of sample mean.

(c) Find the \bar{Y}_{st} and $V(\bar{Y}_{st})$ for the following data : **6**

$$N_1 = 5, \ n_1 = 2, \ \bar{Y}_1 = 8, \ S_1^2 = 21.5$$

$$N_2 = 4, \ n_2 = 2, \ \bar{Y}_2 = 7, \ S_2^2 = 18.5$$

OR

- 5 (a) Explain two methods used in business forecasting. 8
(b) Fit the second degree curve to the following data 12
and estimate the price of the year 2018 :

Year :	2013	2014	2015	2016	2017
Price :	10	12	13	10	8